

K.Z. LEASING & FINANCE LTD.

REGD. OFFICE : DESHNA CHAMBERS, H/H. KADVA PATIDAR VADI, USMANPURA,
ASHRAM ROAD, AHMEDABAD-380014.(GUJARAT) PHONE : 079-27543200
CIN L 65910 GJ 1986 PLC 008864

17th August, 2023.

To,
The Deputy Manager,
Department of Corporate Services,
Bombay Stock Exchange Limited
Dalal Street, Fort
Mumbai - 400 001.

BSE Company Code: **511728**

Dear Sir,

**Sub.: Newspaper Advertisement of Financial Results for the Quarter ended
30th June, 2023.**

**Ref.: Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirement)
Regulations, 2015**

As per the reference above, we hereby submit you the Newspaper copy of the Financial results for the quarter ended on 30.06.2023, as published in the Newspaper in English as well as Gujarati.

Kindly take note of the same.

Thanking you,

Yours Faithfully,

For, K Z LEASING AND FINANCE LIMITED

Ankit P. Patel

**ANKIT
PRAVINKU
MAR PATEL**

Digitally signed by ANKIT PRAVINKU MAR PATEL
DN: cn=ANKIT PRAVINKU MAR PATEL, o=KZ LEASING AND FINANCE LIMITED, ou=KZ LEASING AND FINANCE LIMITED, email=ankit.patel@kzleasingandfinance.com, c=IN
Date: 2023.08.17 11:45:11 +05'30'

ANKIT P PATEL
Director , CFO
(Din: 02901371)

Brijlaxmi Leasing and Finance Limited

Regd. Office: 24, Suvarnapuri Society, Chikwadi, Near Jetalpur Road, Alkapuri, Vadodara 390 007
Website: www.brijlaxmi.com, Email: baro@brijlaxmi.com, baro@brijlaxmi@gmail.com
CIN: L65959GJ1999PLC014183

Extract of Unaudited Financial Results for the First Quarter ended on 30th June, 2023 (Rs. in Lakhs)

Sr. No.	Particulars	Quarter ended		Year ended	
		30.06.2023	31.03.2023	31.03.2023	31.03.2023
		Unaudited	Audited	Unaudited	Audited
1.	Total Income from Operations	64.95	37.13	73.73	383.64
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional Items & or Extraordinary Items)	18.28	7.55	20.14	(8.34)
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	18.28	7.55	20.14	(8.34)
4.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	13.53	5.58	20.14	(8.34)
5.	Total comprehensive income for the period (comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax))	13.53	5.58	20.14	(8.34)
6.	Paid up Equity Share Capital	564.85	564.85	564.85	564.85
7.	Earning per share	0.24	0.10	0.36	(0.15)

Note:
1. The above standalone financial results for the quarter ended 30.06.2023 have been reviewed by the Audit Committee and there after approved and taken on record by the Board of Directors of the Company at their meeting held on 14th August, 2023.
2. The Financial Results for the quarter ended 30th June, 2023 has been reviewed by the Statutory Auditors of the Company.
3. The Company being engaged in Investment and financing activities and accordingly there is no separate reportable segment as per IND AS 108 specified under section 133 of the Companies Act, 2013.
4. Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures. Comparable, wherever necessary.

By the Order of the Board
SD/-
Siddharth Chaturvedi
Managing Director and CFO

Date : 14.08.2023
Place : Vadodara

UCO BANK

PosSESSION NOTICE (for Immovable Property) (Under Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002)

UCO BANK - GIRD-KABILPORE BRANCH, NAVSARI
Opp. Akash Ganga Apartment, Navsar - Grid Road, Kabilpore, Navsari-305424 Phone: 02633-239111

Whereas, The undersigned being the authorized officer of UCO Bank under the securitization and reconstruction of Financial assets and Enforcement of security interest Act, 2002 (No. 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the security interest (enforcement) Rules 2002 issued a demand notice dated 22.05.2023 and calling upon the Borrowers/guarantor Mr. Aidansingh Rugsingh Rajput (Borrower) and Mr. Babul Rugaran Darji (Guarantor) of M/S Bhanu Kirana Store to repay the amount mentioned in the notice being Rs. 9,04,497.96/- (Rupees Nine lakh four thousand four hundred ninety seven and ninety six paise only) plus interest within 60 days from the date of receipt of the said notice.

The borrower and/or Guarantors having failed to repay the amount, notice is hereby given to the borrower and/or guarantor and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 08th day of the August 2023.

The borrower's and/or guarantor's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower and/or guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the Charge of the UCO Bank for an amount Rs. 9,04,497.96/- plus further interest thereon and other charges.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
All the pieces and parcel of immovable property bearing Commercial Shop No 1, measuring area 33.45 sq mtr./yds, Situated at Block No 176 House No 465 Village Amadpore Ta & Dist. Navsari, Sunding in the name of Mr. Aidansingh Rugsingh Rajput. Boundaries are: East: Road, North: Open land, West: Road, South: adj. shop no-2

Date : 08/08/2023
Place : Navsari

Authorized Officer Uco Bank,
Gird Kabilpore Branch, Navsari

K.Z. LEASING AND FINANCE LIMITED

CIN: L65910GJ1988PLC00864
Regd. Office : Deshna Chambers, B/h Kadwa Patidar Wadi, Usmanpura, Ashram Road, Ahmedabad - 380014. Phone: 079-27543200
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER AND THREE MONTHS ENDED ON 30TH JUNE, 2023. (Rs.in Lacs)

Sr. No.	Particulars	Quarter ended on	
		30/06/2023 (Unaudited)	30/06/2022 (Unaudited)
1.	Total Income from Operations	279.52	36.15
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	233.18	7.32
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	223.21	7.32
4.	Net Profit / (Loss) for the period after tax	165.18	7.32
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax))	64.14	(152.14)
6.	Paid up Equity Share Capital	304.12	304.12
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	---	---
8.	Earnings per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) - Basic and Diluted	5.43	0.24

Notes: (1) The above is an extract of the detailed format of First quarter ended Unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the stock exchange website www.bseindia.com & on company's website - www.kzgroup.in (2) The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 27/07/2023 (3) The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2019. Accordingly the Financial Result for the Quarter ended on 30th June, 2023 are in accordance with IND-AS and other accounting principles generally accepted in India. (4) Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

Date: 14/08/2023 For, K.Z. Leasing and Finance Ltd.
Place: Ahmedabad sd/- Pravin Kumar K. Patel (DIN- 00841628)

Asian Petroproducts and Exports Limited

Regd. Office: 24, Suvarnapuri Society, Chikwadi, Near Jetalpur Road, Alkapuri, Vadodara 390 007
Website: www.asianpetro.org, Email: baro@asianpetro.org, baro@asianpetro@gmail.com
CIN: L23209GJ1991PLC016686

Extract of Unaudited Financial Results for the Quarter ended on 30th June, 2023 (Rs. in Lakhs)

Sr. No.	Particulars	Quarter ended		Year ended	
		30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2023
		Unaudited	Audited	Unaudited	Audited
1.	Total income from Operations	0.00	991.13	328.48	1666.38
2.	Net Profit/(Loss) for the period before tax	(11.84)	51.64	(4.06)	14.65
3.	Net Profit/(Loss) for the period after tax	(11.84)	47.98	(4.06)	10.99
4.	Total comprehensive income for the period (comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax))	(11.84)	47.98	(4.06)	10.99
5.	Paid up Equity Share Capital	866.75	769.75	769.75	769.75
6.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year	-	-	-	(961.27)
7.	Earning per share				
	1. Basic (in Rs.)	(0.14)	0.62	(0.05)	0.14
	2. Diluted (in Rs.)	(0.14)	0.06	(0.00)	0.01

Note:
1. The above Financial Results are reviewed by Audit Committee and thereby have been taken on records by Board of Directors in their Meeting held on 14th August, 2023.
2. The Financial Results for the quarter ended on 30th June, 2023 has been reviewed by the Statutory Auditors of the Company.
3. The Company operates only in one segment.
4. Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures.

By the Order of the Board
SD/-
Jaykishor Chaturvedi
Managing Director

Date : 14.08.2023
Place : Vadodara

Canara Bank

Canara Bank Gandhidham Branch
DBZ-N-192, Anshu House, if Front of Hotel Shiv, Ward-12-B, Gandhidham

SYMBOLIC POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorized Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice Dated 15.04.2023 calling upon the Mr. Prakash R. Dabhy to repay the amount mentioned in the notice, being Rs. 5,12,190.34/- (Rupees Five Lakh Twelve Thousand One Hundred Ninety and Thirty Four Paise Only) + further interest and charges there on in the Housing Loan within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general, that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 10th day of August of the Year 2023.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Canara Bank, Gandhidham Branch for an amount of Rs. 5,28,341.34/- (Rupees Five Lakh Twenty Eight Thousand Three Hundred Forty One and Thirty Four Paise Only) + further interest and charges there on in the Housing Loan.

Description of the Immovable Property:
Plot No. 172, Ambaji Residency R. S. No. 395/1 Paik - 1, 395/1 Paik 2, At Village Varsamedi, Taluka - Anjar, District Kutch. The Property is Bounded as under:
North : By 1.52 Mtr Lane East : By Plot No. 171
South : By 9.14 Mtr Road West : By Plot No. 173
Date : 10.08.2023

Authorized Officer,
Canara Bank

Canara Bank

Canara Bank Gandhidham Branch
DBZ-N-192, Anshu House, if Front of Hotel Shiv, Ward-12-B, Gandhidham

SYMBOLIC POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorized Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice Dated 28.03.2023 calling upon the Borrower Mrs. Chhaya A Thacker & Co-Borrower Mr. Arvind Vasant Thacker to repay the amount mentioned in the notice, being Rs. 4,16,873.17/- (Rupees Four Lakh Sixteen Thousand Eight Hundred Seventy Three and Seventeen Paise Only) + further interest and charges there on in the Housing Loan within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general, that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 10th day of August of the Year 2023.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Canara Bank, Gandhidham Branch for an amount of Rs. 4,42,053.17/- (Rupees Four Lakh Forty Two Thousand Fifty Three and Seventeen Paise Only) + further interest and charges there on in the Housing Loan.

Description of the Immovable Property:
Plot No. 56/B, R. S. No. 890/19, Ambaji Nagar-2, At Village Varsamedi, Taluka : Anjar, District Kutch. The Property is Bounded as under:
North : By Plot No. 55/A East : By 7.50 Mtr Road
South : By Plot No. 56/A West : By Plot No. 59
Date : 10.08.2023

Authorized Officer,
Canara Bank

ASHIANA ISPAT LIMITED

Regd. Office: A-1116, RIICO Ind. Area, Phase - III, Bhiwadi, Distt. Alwar (Rajasthan)-301019
E-mail:- ashianagroup@yahoo.co.in, Web : www.ashianaispat.in
CIN - L27107RJ1992PLC006811

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2023 (Rs. in lakhs)

Sl. No.	Particulars	Quarter-ended		Year ended	
		30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2023
		Un-Audited	Audited	Un-Audited	Audited
1	Total income from operations	5,928.87	14,409.20	14,393.66	46,554.01
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-34.66	12.40	77.10	344.43
3	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	-43.65	9.16	63.62	299.71
4	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-43.65	9.16	63.62	299.71
5	Equity Share Capital	796.48	796.48	796.48	796.48
6	Other Equity	-	-	-	2,917.60
7	Earnings Per Share (of Rs. 10/- each) (not annualised)				
	Basic	-0.55	0.12	0.80	3.76
	Diluted	-0.55	0.12	0.80	3.76

Note:
1. The above is an extract of the detailed format of Quarterly financial results for the quarter ended June 30, 2023 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly results is available on the stock exchange website www.bseindia.com and on the company website www.ashianaispat.in.
2. The Statement has been prepared in accordance with Companies (Indian Accounting Standards) Rules, 2015 prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.
3. Figures have been re-grouped wherever necessary to conform to current quarter's classification.
4. The above results were reviewed by Audit Committee and approved by the Board of Directors in their meeting held on 14th August, 2023. The Auditors have expressed unmodified opinion on the financial statements of the Company.

Place: Delhi
Date: 14.08.2023

For and on behalf of the Board of Directors
For Ashiana Ispat Limited
(Puneet Jain)
Managing Director
DIN-00814312

SWARNARITA JEWELS INDIA LIMITED

(Formerly Known as Swarnsarita Gems Limited)
CIN: L38911MH1992PLC068283
Regd. Office: 10, 1st Floor, Plot 40/42, Ruby Chambers, Dhanji Street, Zaveri Bazar, Mumbai-400003
Tel. No.: 022-43590000 E-mail: info@swarnsarita.com Website: www.swarnsarita.com
EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR QUARTER ENDED JUNE 30, 2023 (Rs. in Lakhs)

Particulars	STANDALONE			CONSOLIDATED		
	Quarter ended on 30.06.2023	Quarter ended on 30.06.2022	Year ended on 31.03.2023	Quarter ended on 30.06.2023	Quarter ended on 30.06.2022	Year ended on 31.03.2023
	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Audited
Total income from operations (net)	17291.52	20957.21	85168.66	19444.13	20943.86	84305.21
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or extraordinary items)	627.35	369.98	681.85	743.58	355.62	841.11
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items)	627.35	369.98	681.85	743.58	355.62	841.11
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items)	470.51	277.49	510.10	557.68	266.71	629.16
total comprehensive income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	470.51	277.49	504.46	557.68	266.71	623.52
Paid up Equity Share Capital (Face Value of Rs 10/- each fully paid up)	2083.76	2083.76	2083.76	2083.76	2083.76	2083.76
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-	-	-	-
Earnings Per Share (before & after extraordinary items) (face value of Rs 10/- each)						
a) Basic:	2.25	1.33	2.44	2.67	1.28	3.01
b) Diluted:	2.25	1.33	2.44	2.67	1.28	3.01

Notes:
The above is an extract of the detailed format of Quarterly/ Yearly Financial Result filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the Quarterly/ Yearly Financial Result are available on the website of the Stock Exchange i.e. www.bseindia.com. The same are also available on the Company website i.e. www.swarnsarita.com.

For SWARNARITA JEWELS INDIA LIMITED
SD/-
SUNNY MAHENDRA CHORDIA
WHOLE-TIME DIRECTOR
DIN: 06664041

Place: Mumbai
Date: 14.08.2023

ADINATH EXIM RESOURCES LIMITED

CIN: L65100GJ1995PLC024300
601, Astron Tower, Opp. Iskon Mandir, Nr. Casalla Tower, Satellite, Ahmedabad-380015, Gujarat
Ph. 6351738619 E-mail: aernodalofficer@gmail.com Website: www.adinatheximresources.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2023 (Rs. In Lacs except EPS)

Sr No	Particulars	Standalone			
		Quarter Ended		Year Ended	
		30.06.2023 (Unaudited)	31.03.2023 (Audited)	30.06.2022 (Unaudited)	31.03.2023 (Audited)
1	Total Income from Operation(Net)	25.68	25.18	23.58	99.73
2	Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	18.12	20.96	15.90	67.92
3	Profit / (Loss) for the period after Exceptional (before tax and Extraordinary items)	18.12	20.96	15.90	67.92
4	Profit / (Loss) for the period after Exceptional and/or Extraordinary items (before tax)	18.12	20.96	15.90	67.92
5	Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	13.56	34.69	5.97	68.11
6	Equity Share Capital	431.91	431.91	431.91	431.91
7	Other Equity	0.00	0.00	0.00	1242.20
8	Earning Per Share (Face Value of ₹10/- each) Basic & Diluted	0.31	0.80	0.14	1.58

Notes:
(1) The above is an extract of the detailed format of unaudited Financial Results for the Quarter ended on June 30, 2023 filed with Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosures Requirements) Regulations, 2015. The full format of unaudited financial results of the Company for the Quarter ended on June 30, 2023 are available on the Company's website www.adinatheximresources.com and website of the Stock Exchange www.bseindia.com
(2) The above results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on August 14, 2023.

For, ADINATH EXIM RESOURCES LIMITED
SD/-
Manoj S. Savie
Managing Director
(DIN: 01529306)

Place: Ahmedabad
Date: 14.08.2023

HDFC BANK

HDFC Bank Ltd.
HDFC House, Nr. Mithakhali Six Road, Navrangpura, Ahmedabad. Phone : (079) 66307000

POSSESSION NOTICE

Whereas the Authorised Officer(s) of HDFC Bank Ltd. (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice(s), incidental expenses, costs, charges etc. till the date of payment and / or realisation.

Sr. No.	Name of Borrower(s)/ Legal Heir(s)/ Legal Representative(s)	Outstanding Dues Rs. As on Dt.*	Date of Demand Notice	Date of Possession Physical/ Symbolic	Description of Immovable Property(ies)/ Secured Asset(s)
(a)	(b)	(c)	(d)	(e)	(f)
1	Wife/Son/ Husband/Daughter of Mr. SURESHCHAND SHRIRAMLAL SHRIVASTAV [Since Deceased] And other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assnigns of MR. SURESHCHAND SHRIRAMLAL SHRIVASTAV [Since Deceased] (Borrower)	Rs. 10,10,590/- as on 31-May, 2022*	20-June, 2022	12-Aug., 2023 Physical Possession	HOUSE 58, S. NO. 693/P-2, SAGAR RESIDENCY COLONY, VILLAGE-VARSAMEDI, ANJAR-BHACHAU ROAD, AFTER WELSPUN CITY, ANJAR-370110.
2	MR. NATVARLAL BHIKHABHAI VANKAR (Borrower)	Rs. 7,67,227/- as on 31-Mar, 2023*	09-May, 2023	11-Aug., 2023 Symbolic Possession	HOUSE-75/A, S. NO. 402, GOKULDHAM-GANSHYAM NAGAR COLONY, VILLAGE-MADHAPAR NAVAVAS, NR. INDRAVILLA SOCIETY, BHUJ-370001.
3	MR. DINESH NAIR(Borrower) MRS. JALJA NAIR (Co-Borrower)	Rs. 13,31,647/- And Rs. 1,12,691/- Respectively as on 30-June, 2019*	14-Aug, 2019	11-Aug., 2023 Symbolic Possession	HOUSE 11/B, S. NO. 187, VIDHYUT VIHAR COLONY, VILLAGE-BAROI, NR. ST. XAVIER'S SCHOOL, MUNDRA-370421.

*With further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realisation.

However, since the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorized Officer(s) of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) have taken possession of the immovable property (ies) / secured asset(s) described hereinabove in exercise of powers conferred on him/ them under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above.

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Immovable Property (ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC Bank Ltd.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Copies of the Panch-nama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) is / are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Date : 14-08-2023
Place : Ahmedabad

For, HDFC Bank Ltd.
SD/-
Authorized Officer

Regd. Office : HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013.
CIN : L65920MH1994PLC080618, Website : www.hdfcbank.com

MAXIMUS INTERNATIONAL LIMITED

Regd. Office : 504A, "OZONE", Dr. Vikram Sarabhai Marg, Vadi-wadi, Vadodara - 390003. Ph: 0265 - 2345321 Website: www.maximusinternational.in
Email: info@maximusinternational.in CIN: L51900GJ2015PLC085474

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2023 (Rs. in Lakhs)

Sr. No.	Particulars	Consolidated			
		Quarter Ended		Year Ended	
		30.06.2023 (Unaudited)	31.03.2023 (Audited)	30.06.2022 (Unaudited)	31.03.2023 (Audited)
1	Total Income from operations (Net)	2142.92	2344.78	2387.71	10128.14
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	133.83	145.14	245.86	790.39
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items)	133.83	145.14	245.86	790.39
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary Items)	135.26	133.95	212.97	728.78
5	Total Comprehensive Income for the period	108.06	110.47	260.77	778.49
6	Equity Share Capital (Face Value Rs.10/- per share)	1257.20	1257.20	1257.20	1257.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	1948.51
8	Earnings Per Equity Share on net profit after tax (Fully paid-up equity share of Rs. 10/- each)				
	Basic:	0.11	0.11		

